

મકાઈની ખેતી

મકાઈની સુધારેલી જાતો : ગુજરાત મકાઈ-૨, ૩, ૪, ૫, નર્મદામોતી, , ગંગાસિફેદ ૨,

બિયારણ કેટલું જોઈશે ? : એક એકર માટે ૮ કીલો બિયારણ જોઈશે.

જમીન : સારા નિતારવાળી, ફળકૃપ, સમતળ, ગોરાળુ, મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. ઢાળ વાળી જમીન હોય તો ઢાળની વિરુદ્ધ દિશામાં ચાસ કાઢીને વાવેતર કરવું જોઈશે

જમીનની તૈયારી : ટ્રેક્ટરથી અથવા હળથી એક વેંત જેટલી (૬-૮ ઈચ) ઉડાઈવાળી ઉભી અને આડી ખેડ કરવી, જેથી જમીનમાં રહેલા રોગના જીવાણુઓ તથા જીવાતના ઈડા નાશ થાય અને જમીનમાં બેજ સંગ્રહ થાય. આ ઉપરાંત અગાઉ કરેલ પાકના જડીયા, કચરો વીણીને ખેતર સાફ કરવું જેથી ઉઘદીથી બાચી શકાય. એક એકરમાં ૧૦ ગાડલા છાણીયું ખાતર નાખીને ઉભી- આડી ખેડ કરવી અને સમાર મારીને જમીન તૈયાર કરવી. જમીનમાં ઉઘદી, કૂમિ, મુળખાદ તથા જમીનજન્ય નુકશાન કરતા જીવાણુઓ અને કુગ સામે રક્ષણ મેળવવા માટે ૧૦ લિટર પાણીમાં ૧૦૦મીલી. જૈવિક નીયંત્રકોનું (નીમાસ્ત્ર) દ્વારા બનાવીને જમીનમાં આપવું.

વાવણીનો સમય : ચોમાસામાં વાવણી લાયક સારો વરસાદ થયા બાદ વાવણી કરવી (જુન-જુલાઈ માસ). શિયાળુ પાક માટે દિવાળી પછી નવેમ્બર ના પહેલા પખવાડીયામાં વાવેતર કરવું.

બિયારણને પટ આપવો: ૧૦ કીલો મકાઈના બિયારણને ૫૦૦મીલી બાયો કલ્યર નો પટ આપવો જેનાથી છોડની વૃદ્ધિ વિકાસ સારો થશે. બિયારણ પટ આપવાથી બીજ જન્ય રોગો જેવાકે સુકારા સામે રક્ષણ મળે છે.

બિયારણ વાવવાનું અંતર: મકાઈને બે ફુટના(એક ડગલાના) ગાળે વાવવી અને બે છોડ વચ્ચે એક ફૂટ(બે વેંત) જેટલું અંતર રાખવું. (૬૦ x ૩૦ સેમી.)

ખાતરો : મકાઈના પાકમાં એક એકર જમીનમાં પાયાના ખાતર તરીકે ૨૦ બેગ અખસિંયાનું ખાતર/ સેલરીચ ચાસમાં આપવું. ૨૦૦ લિટર પાણીમાં રલીટર અમૃતપાણી મેળવીને યોગ્ય રીતે હલાવીને દ્વારા બનાવવું આ દ્વારાણને એક એકર જમીનમાં પાણી સાથે આપવું. એક લિટર પાણીમાં ૧૦ મી.લી. મુજબ અમૃતપાણી મેળવીને યોગ્ય રીતે હલાવીને દ્વારા બનાવવું. આ દ્વારાણને ૧૫-૨૦ દિવસના ગાળે છોડના પાંદડા પર પંપથી છાંટવું જેનાથી છોડની વૃદ્ધિ, વિકાસ સારો થશે. અમૃતપાણી જમીનમાં રહેલા ઉપયોગી સૂક્ષ્મતત્વોને સહેલાઈથી છોડને પહોંચાડે છે, તદઉપરાંત હવામાં રહેલા નાઈટ્રોજનનું રૂપાંતર કરીને છોડને પુરો પાડે છે.

આ ઉપરાંત જમીનની ચકાસણી કર્યા બાદ કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ એક એકરમાં નીચે મુજબના રાસાયણિક ખાતરો નાખી શકાશે.

ચોમાસુ પાક : સુધારેલી જાત માટે નાઈટ્રોજન ૨૫ કીલો, ફોસ્ફરસ ૧૫ કીલો નાખવું.

શિયાળુ પાક : સુધારેલી જાત માટે નાઈટ્રોજન ૫૦ કીલો, ફોસ્ફરસ ૨૫ કીલો નાખવું.

નિંદામણ અને આંતરખેડ : ચોમાસામાં મકાઈના છોડ કરતા ઘાસ કચુ વહેલુ ઉગી નિકળે છે. ઘાસ કચુ ઝડપથી વધે છે તેથી મકાઈના છોડ નબળા પડી જાય છે અને ઉત્પાદન ઓછુ આવે છે. કરબડીથી દર અઠવાડીયે આંતરખેડ

કરીને કચુ વીજી લેવુ અને મકાઈના છોડના ફરતે હાથથી નિંદામણ દુર કરવુ. વધારે વરસાદ હોય ત્યારે આંતરખેડ થઈ ન શકે તો છોડના ફરતે હાથથી નિંદામણ કરવું.

પિયત વ્યવસ્થા : ચોમાસામાં વરસાદની ખેંચ પડે અને જમીનમાં પુરતો બેજ ન હોય ત્યારે જરૂરીયાત પ્રમાણે પાણી આપવું. શિયાળુ મકાઈ પાકમાં વાવેતર સમયે, પીલા કુટે ત્યારે, છોડ એક વેંતનો થાય ત્યારે, છોડ બે કુટનો થાય ત્યારે, માંજર નિકળે ત્યારે, દુધ ભરાય ત્યારે, દાણા ભરાય ત્યારે એમ રૂ-૭ પાણી આપવા. જમીનમાં બેજ જોઈને પાણી આપવું.

રોગ જીવાત અને તેનું નિયંત્રણ : નુકશાન કરતી ઈયળો, ગાભમારાની ઈયળ માટે અલ્ટીમેટ દવા તેમજ ડોડાની કોરી ખાનાર જીવાતો ના ઉપદ્રવ અટકાવવા માટે ૧૦ લિટર પાણીમાં ૩૦-૪૦મીલી. કલોરોપાથરીઝોસ દવાનું દ્વારા બનાવીને સરખી રીતે હલાવીને છોડ પર પંથી છાંટવું. આ દ્વારા બનાવીને મકાઈ રૂંગી નિકળ્યા બાદ દર પંદર દિવસના આંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.

રોગ જીવાતોનું પ્રમાણ કષ્મય માત્રા કરતા વધુ જણાય તો કૃષિ યુનિવર્સિટીની નીચે મુજબની ભલામણ પ્રમાણે પગલા લેવા.

કાપણી : મકાઈ ડોડાનાં ફોતરા સુકાઈને પીળા થાય ત્યારે તથા દાણા પાકા થયા બાદ ડોડા કાપી લેવા. ડોડાને છાલ કાઢીને ખળામાં સુકવવા માટે રાખવા.

ઉત્પાદન :

જાત	ચોમાસુ પાકમાંથી ઉત્પાદન	શિયાળુ પાકમાંથી ઉત્પાદન
સુધારેલી જાત	એક એકરમાંથી ૫૦-૬૦ મણ	એક એકરમાંથી ૭૫-૮૦ મણ



શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ વડોદરા સંચાલિત વિવેકાનંદ સેન્ટર ફોર એગ્રીકલ્યુરલ સર્વિસીસ.